

647510**23MA04PhiC115x**

Seat No : _____

M.A. (PHILOSOPHY) Semester - 4 (CBCS) Examination
March/April-2026 (As Per Syllabus Year June-2024)
Yogsutra(Core (New-23))

Time: 2:30 Hours**Marks:70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧	યોગ દર્શનના સાહિત્યનો પરિચય આપો તથા તેના મુખ્ય ગ્રંથોનું વિશ્લેષણ કરો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૧	સાંખ્ય અને યોગ દર્શન વચ્ચેના મુખ્ય તફાવતો અને સમાનતાઓ સમજાવો.	
પ્રશ્ન-૨	ચિતવૃત્તિ શું છે? તેના પ્રકારો નું વિસ્તૃત વર્ણન કરો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૨	પંચકલેશ શું છે? તેના પ્રકારોનું વિશ્લેષણ કરો.	
પ્રશ્ન-૩	ચિતભૂમિના પ્રકારો સમજાવી તેની વિશેષતાઓ વર્ણવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૩	અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આત્મસાક્ષાત્કાર કેવી રીતે શક્ય બને છે તે સમજાવો.	
પ્રશ્ન-૪	ચિત્તશુદ્ધિ માટેના ઉપાયોનું વર્ણન કરો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૪	અષ્ટાંગમાર્ગ સમજાવો.	
પ્રશ્ન-૫	કોઈપણ બે પ્રશ્નોના ઉત્તર આપો.	(૧૪)
	1) યમના પ્રકારો સમજાવો.	
	2) વૈરાગ્ય શું છે? તેના પ્રકારો સમજાવો.	
	3) આધુનિક જીવનમાં યોગના હેતુ અને ઉપયોગિતા પર ચર્ચા કરો.	
	4) યોગમાર્ગ દ્વારા પ્રાપ્ત થતી સિદ્ધિઓનું વર્ણન કરો.	

ENGLISH VERSION

Que.1	Give an introduction to the literature of Yoga and analyze its main texts.	(14)
	OR	
Que.1	Explain the main similarities and differences between Sankhya and Yoga philosophy.	
Que.2	What is Chitta Vritti? Describe its types.	(14)
	OR	
Que.2	What are the Panch Kleshas? Analyse their types.	
Que.3	Explain the types of Chitta Bhumi and describe their characteristics.	(14)
	OR	
Que.3	Explain how self-realization can be attained through Abhyasa (Practice) and Vairagya(detachment).	
Que.4	Describe the methods for purification of the Chitta.	(14)
	OR	
Que.4	Explain Astangmarg.	
Que.5	Answer any two.	(14)
	1) Explain the types of Yam.	
	2) What is Detachment? Explain its types.	
	3) Discuss the purpose and usefulness of Yoga in modern life.	
	4) Describe the sidhdhis attained in the path of yoga.	
